



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,
અમદાવાદ.

અરજી ક્રમાંક : RZ2017 0919/3935

અરજી તારીખ :- ૧૮-૧૧-૨૦૧૭.

પહોંચ નં. ૭૩૩/115

અરજદારશ્રી અમીન શાહ દી. પટેલ
અમીન શાહ
અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અનુસાર
રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર થઈ તા.૨૦/૧૨/૨૦૧૪ થી અમલમાં આવેલ ઓડા દ્વારા તૈયાર થયેલ ક્ષિતિય પુનરાવર્તિત
વિકાસ યોજના-૨૦૨૧ મુજબના નકશાના આધારે.

મોજે/રેવન્યુ ગામ :- અમીન શાહ

બ્લોક નંબર :- ૫૭૦

રી.ડી.પી. શીટ નંબર ૬૮

ની જમીન ૭૦૨ ચો. ફીટ જેમાં ૧૮૦૦ + ૬૦૦ + ૧૬૦૦ ચો.
ફીટ રોડ તથા ૫૫૦ ચો. ફીટ વચ્ચેના ૫૫૦ ચો.
૪૦૦૦ ચો. ફીટ જમીનમાં ગાય છે.

માં આવે છે.

નોંધ :

૧. સહરજી જમીન પ્રક્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૫૩/૮ અમીન શાહ ના વિસ્તારમાં આવતી હોવાથી તેને ટા. પ્લા. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો - જોગવાઈઓ ફેરફારને તથા ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રીના નિર્ણયને બંધનકર્તા રહેશે.
૨. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

તારીખ : ૨૦-૧૧-૨૦૧૭

અમીન શાહ
૨૦/૧૧/૨૦૧૭

જ. ડાક્ટરસમેન

હેડ ડાક્ટરસમેન

મરી નકલ

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર

PART PLAN OF DRAFT TOWN PLANNING SCHEME NO:53/A(SHILAJ -THALTEJ-HEBATPUR.)

Sanctioned Under Government Notification

Urban Development and Urban Housing

Department NO. GH/V/196 OF 2012/TPS-112008-2620-L Dt:28-09-2012

FINAL PLOT NO: 121

ORIGINAL PLOT NO: -



SCALE: 1c.m.=25 m.



This part plan is certified for the F.P NO: 121

Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition /Alteration .

(2) Final plots boundary and allotment of final plot as subject to variation.

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોકવાઈનની અસર/ ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/ અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. 20.09.19/5696 તા. 19.9.17 થી નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. 222/112 તા. 19.9.17 રૂ. 1000/- નકલ લઈ નકલ આપવામાં આવેલ છે.

LEGEND

- O.P BOUNDARY
- F.P BOUNDARY
- ROAD
- T.P.S BOUNDARY

Prep. By

Chd. By:

TRUE COPY

TOWN PLANNING INSPECTOR
TOWN PLANNING DEPARTMENT
AHMEDARAD MUNICIPAL CORPORATION

PART PLAN SHOWING
BLOCK NO.- 570
VILLAGE :- SHILAJ
TALUKA:- GHATLODIYA
DISTRICT:- AHMEDABAD



1 c.m. = 20 mt.

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt.of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.

LEGEND

- Existing Road
- Village Boundary
- TPS Boundary
- Proposed Road
- SP Ring Road



This part plan is certified for the BLOCK NO. :- 570

- NOTE :-
- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
 - (2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2017.....22/9/.....3934
Amount Recieved Rs.1,000/-
Receipt No.....733...../114..... Dtd.....19/9...../2017.

TRUE COPY

[Signature]
21/9/2017

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION

[Signature]
21/9/2017